



Accredited Grade "A" by NAAC(3rd Cycle)

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

પરીક્ષા વિભાગ ૦૨, યુનિવર્સિટી કેમ્પસ, યુનિવર્સિટી રોડ, રાજકોટ – ૩૬૦૦૦૫

ફોન નં. : (૦૨૮૧) ૨૫૭૬૫૧૧ એક્સટે. નં. ૭૩૪ / ૩૦૧ / ફેક્સ નં. : (૦૨૮૧) ૨૫૮૬૪૧૧

ઈ-મેઈલ : exam02@suuuni.ac.in

નં/પરીક્ષા/૦૨/ 652/2020

તા.02/12/2020

MODIFIED – 02 પરિપત્ર:

આથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન મેડીકલ / પેરા મેડીકલ વિદ્યાશાખા સિવાયનાં સંબંધિત કોર્સની કોલેજના આચાર્યશ્રી / ભવન ના અધ્યક્ષશ્રીઓ / સંસ્થાના વડાઓ ને જણાવવાનું કે, સને ૨૦૨૦-૨૧ નાં પ્રથમ સત્ર દરમ્યાન લેવાનાર સ્નાતક / અનુસ્નાતક પરીક્ષાઓમાં જે વિષયોમાં પ્રાયોગિક પરીક્ષા યોજવાની થાય છે તે પ્રાયોગિક પરીક્ષાઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એકેડેમિક કાઉન્સિલના ઠરાવ નંબર ૪૮ તા.૨૮/૧૦/૨૦૨૦ તેમજ સિન્ડિકેટ સભાના ઠરાવ નંબર -૧૬(૪૮) તા.૦૫/૧૧/૨૦૨૦ મુજબ. હાલની COVID -19 પરિસ્થિતિને કારણે સ્નાતક કક્ષાના જે તે વિષયના પ્રેક્ટીકલ લેકચર / પ્રીપ્રેરેશન ન થવાને કારણે પ્રેક્ટીકલ પરીક્ષાને બદલે “ પ્રેક્ટીકલ VIVA “ યોજવા.

CBCS અંતર્ગત સ્નાતક કક્ષાએ ૧૦ સેમેસ્ટરનો અભ્યાસક્રમ હોય ત્યાં સેમેસ્ટર ૧,૩,૫,૭, તેમજ ૬ સેમેસ્ટરનો અભ્યાસક્રમ હોય ત્યાં સેમેસ્ટર ૧,૩ ના રેગ્યુલર તેમજ રીપીટર વિદ્યાર્થીઓની પ્રાયોગિક પરીક્ષા(પ્રેક્ટીકલ VIVA) કોલેજ કક્ષાએ (સ્થાનિક ધોરણે) જે તે કોલેજના આચાર્યશ્રીઓ દ્વારા અત્યારથી શરૂ કરીને જે તે સત્રની થિયરી પરીક્ષા પૂર્ણ થયા બાદ ૨૫ દિવસના સમયગાળામાં પૂર્ણ કરી નિર્ધારિત સમય મર્યાદામાં તેના ગુણની ઓનલાઇન એન્ટ્રી કરવાની રહેશે.

સ્નાતક કક્ષાએ ૧૦ સેમેસ્ટરનો અભ્યાસક્રમ હોય ત્યાં સેમેસ્ટર ૮ તેમજ ૬ સેમેસ્ટરનો અભ્યાસક્રમ હોય ત્યાં સેમેસ્ટર ૫ ની પ્રાયોગિક (પ્રાયોગિક VIVA) તેમજ પ્રોજેક્ટ વાઈવા પરીક્ષા યુનિવર્સિટી એ નિર્ધારિત કરેલ ટાઈમ ટેબલ મુજબ લેવામાં આવશે.


અનુસ્નાતક કોર્સની પ્રાયોગિક પરીક્ષા (પ્રેક્ટીકલ VIVA) અત્યારથી શરૂ કરીને સંબંધિત થીયરી પરીક્ષા પૂર્ણ થયા બાદ ૨૫ દિવસના સમયગાળામાં પૂર્ણ કરવાની રહેશે.

::- સૂચનાઓ ::-

- (૧) આચાર્ય દ્વારા ગોઠવાયેલ ઉપરોક્ત પરીક્ષાઓના કાર્યક્રમની બે નકલ તેમજ આચાર્યશ્રી દ્વારા પ્રાયોગિક પરીક્ષાના પરીક્ષકોને અપાયેલા નિમણુંકના ઓર્ડરની એક નકલ પરીક્ષા શરૂ થયાના ૦૩ દિવસ પહેલા પરીક્ષા નિયામકશ્રી, પરીક્ષા વિભાગને મોકલી આપવાની રહેશે.
- (૨) વિદ્યાર્થીઓનાં સીટ નંબરની યાદી જે કોલેજને મળેલ ન હોય તેવા સંજોગોમાં વિદ્યાર્થીઓના નામ અને એનરોલમેન્ટ નંબર ઉપર પ્રાયોગિક પરીક્ષા લેવાની રહેશે.(પ્રાયોગિક પરીક્ષાની ઉત્તરવહીઓ સંસ્થાએ નિર્ધારિત સમય સુધી સાચવવાની રહેશે.)
- (૩) વધુમાં જણાવવાનું કે આચાર્યશ્રીઓએ પ્રાયોગિક પરીક્ષામાં પોતાની કોલેજનાં સીનીયરમાન્ય અધ્યાપકોને નિમણુંક આપી પ્રાયોગિક પરીક્ષાઓ લેવાની રહેશે, અને જો કોલેજમાં માન્ય અધ્યાપક ન હોય તો, ત્યાંથી નજીકની કોલેજમાંથી માન્ય અધ્યાપકનો સંપર્ક કરીને પરીક્ષા પૂર્ણ કરવાની રહેશે.
- (૪) (અનુદાનીત- ગ્રાન્ટેડ)પ્રાયોગિક પરીક્ષાના સંચાલન પેટે જે તે કોલેજનાં આચાર્યશ્રીને કો-ઓર્ડિનેટર તરીકે નિમણુંક કરવા અથવા આચાર્યશ્રી જે અધ્યાપકને નિયુક્ત કરે તેમને રૂ.૧૨૫/- (રૂપિયા એકસો પચ્ચીસ)નું મહેનતાણું પ્રતિ-દિન ચુકવવું. આ ફક્ત ગ્રાન્ટેડ કોલેજોને જ લાગુ પડશે.

(૫) આ કાર્યાલયનાં તા.૧૭.૦૮.૨૦૦૯ નાં પરિપત્ર ક્રમાંક પરીક્ષા/૦૨/૧૫૫૧/૨૦૦૯ અનુસાર સેલ્ફ ફાઈનાન્સ કોલેજ તથા ગ્રાન્ટેડ કોલેજોમાં સેલ્ફ ફાઈનાન્સ કોર્ષ ચલાવતી કોલેજોએ પ્રાયોગિક પરીક્ષા સંચાલનનો તમામ ખર્ચ ભોગવવાનો રહેશે, ખર્ચનાં હિસાબોની ફાઈલ યુનિવર્સિટીનીમાં જમા કરાવવાની રહેશે નહીં, પરંતુ પ્રાયોગિક પરીક્ષા સંચાલન ખર્ચનાં તમામ હિસાબો તૈયાર કરી કોલેજ પોતાના રેકોર્ડ ઉપર રાખવાના રહેશે. જે યુનિવર્સિટીની જરૂરીયાત ઉભી થયે માંગવાથી રજુ કરવાનાં રહેશે

(૬) ઉપર મુજબની જાણ કોલેજનાં શૈક્ષણિક/બિનશૈક્ષણિક કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓના ધ્યાન પર મૂકવા અને જરૂરી વ્યવસ્થા ગોઠવવા યોગ્ય કરશોજી.


પરીક્ષા નિયામક

પ્રતિ,

૦૧. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોનાં આચાર્યશ્રીઓ .

૦૨. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્થિત ભવનના અધ્યક્ષશ્રીઓ

૦૩. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માન્ય સંસ્થાના વડાશ્રીઓ

નકલ સાદર રવાના:

૦૧. માન. કુલપતિશ્રી/માન.કુલનાયકશ્રી/માન. કુલસચિવશ્રીનાં અંગત સચિવશ્રી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.

નકલ રવાના :

૦૧. મુખ્ય હિસાબી અધિકારીશ્રી, હિસાબ વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.

૦૨. ઓડિટરશ્રી, ઓડીટ વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.

૦૩. પરીક્ષા કોમ્પ્યુટર વિભાગ

૦૪. વિભાગીય અધિકારીશ્રી, પારીક્ષા વિભાગ -૦૧ અને ૦૩ તથા MINDLOGICX સેન્ટર

૦૫. પરીક્ષા સ્ટોર્સ વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ. (પ્રાયોગિક પરીક્ષાઓ માટેની ઉત્તરવહીઓ તથા ગ્રાફ પેપર્સ જે તે કોલેજને સમયસર પહોંચતી કરવા અર્થે)